

તસ્થી: નિવાણિતંક્રા
વજન: લગાગા લગાગા લગાગા લગા

પંચમ શુક્રાવ

અચાનક અકળ કે દ્રવી જાય છે,
જીલું ત્યાં જ એ જરમરી જાય છે.

ધધભતાં હદ્યની ધમણ કૂંક પર,
રૂધિર લોહરસમાં ઢળી જાય છે.

સરી જાય વિષદંશનું યે દહન,
સ્મરણ એક એવું ડસી જાય છે.

રસસ્વિફ્ત સકળ અવયવો શુષ્ણ થઈ,
ક્રમેક્રમ ક્રમશઃ ખરી જાય છે.

મૂડી સ્વમને બાણશૈયા ઉપર,
સ્વયં ઊધ જોકે ચૂડી જાય છે.

સ્વયં ઊધ જોકે ચૂડી જાય છે,
અચાનક અકળ કે દ્રવી જાય છે.

લંડન, જૂલાઈ ૨૦૦૪